

પહેલી વાત તો હંમેશા એ યાદ રાખવી જોઈએ કે ઈસ્લામ અનુસાર કર્મ કરવાનો આધાર તકવા છે માટે તકવાને સામે રાખતા રોજા વિશે, હજરત મસીહ મૌઓઉદ અ.સ. ના કથનો ને સામે રાખીએ કે આપણા રોજાને ખુદા માટે સર્ચાઈ સાથે પુરા કરો.

## સારાંશ ખુલ્બા : જુમ્મા સૈયદના ખલીફતુલ મસીહિલ ખામિસ અયદહુલ્લાહુ તઆલા બિનસ્રિહિલ અગ્રીજ તા. ઉ. દ. ૨૦૧૬ સ્થળ બૈતુલ. ફતુહ લંડન

હજુર અનવરે ફરમાવ્યુ કે ઈન્શાઅલ્લાહ ગ્રા ચાર દિવસ પછી રમાતુર મુખારકનો મદીનો શરૂ થનાર છે. રોજા ઈસ્લામના મુળ સિધ્ઘાંતોમાંથી છે. તથા તેમને પુરા કરવા અનિવાર્ય છે. રોજા વિશે અમુક નાના નાના પ્રશ્નો પણ ઉકે છે. સંહેરીના સમય વિશે, અફતારીના વિશે બીમારી વિશે, યાત્રા વિશે આ રીતે વિભન્ન પ્રકારના પ્રશ્નો થાય છે. આ યુગમાં અલ્લાહ તઆલાએ હજરત મસીહ મૌઓઉદ અ.સને નિષાયિક તથા ન્યાયિક બનાવીને મોકલ્યા છે. જેમણે ઈસ્લામી શિક્ષા અનુસાર પ્રત્યેક વાતનો નિષય કરવાનો હતો અને કર્યા તથા પ્રત્યેક સમસ્યાનો સમાધાન બતાવવું હતું. અને બતાવ્યુ આ યુગમાં આપણે આપણી સમસ્યાઓના નિવારણ તથા જ્ઞાનમાં વૃદ્ધિ માટે આપ અ.સ. તરફ જોવાની આવશ્યકત છે અત્યારે રોજા વિશે અમુક પ્રશ્નોના ઉત્તર અથવા હજરત મસીહ મૌઓઉદ અ.સ.નો આ વિષયમાં શુ દ્રષ્ટિકોણ હતો બધાન કરીશ .

હજુર અનવર એ ફરમાવ્યુ પહેલી વાત તો હંમેશાઓ યાદ રાખવી જોઈએ કે ઈસ્લામ અનુસાર કર્મ કરવાનો આધાર તકવા છે માટે તકવાને સામે રાખતા રોજા વિશે, હજરત મસીહ મૌઓઉદ અ.સ. ના કથનો ને સામે રાખીએ કે આપણા રોજાને ખુદા માટે સર્ચાઈ સાથે પુરા કરે .

એકવાર હજરત મસીહ મૌઓઉદ અ.સ. ની સેવામાં પ્રશ્ન પેશ થયો કે રોજો તો બુધવારે રાખવો જોઈતો હતો અમારે ત્યાં ચુરુવારે રખાવ્યો હવે શુ કરવું જોઈએ હજરત મસીહ મૌઓઉદ અ.સ. એ ફરમાવ્યુ કે આના બદલામાં રમાતુર મહિના પછી એક રોજો રાખવો જોઈએ જે રોજો છુટી ગયો તે રમાતુર પછી પુરો કરો. .

તેવી જ રીતે સહેરી ખાવાની વાત છે સહેરી ખાઈને રોજો રાખવો જરૂરી છે. આહેરત સ. અ. વ. એ પણ આપણોને એ જ આદેશ આપ્યો છે. એક હદીસામાં આવે છે કે આપ સ. અ. વ. એ ફરમાવ્યુ કે રોજાના દિવસોમાં સહેરી ખાવો કેમ કે સહેરી ખાઈ ને રોજા રાખવામાં બરકત છે. હજરત મસીહ મૌઓઉદ અ.સ. એની પાંબંદી કરતા હતા તથા જમાઅત ના લોકોને કહેતા હતા કે સહેરી જરૂરી છે તેવી જ રીતે જે મહેમાન કાદીયાનમાં આવતા તેમના માટે પણ સહેરીનો વિધિવત્તં પ્રબંધ થતો હતો બલ્કે મોટી વ્યવસ્થા કરતા હતા. હજરત મુસ્લેહ મૌઓઉદ રજી બધાન કરે છે કે અલ્લાહ તઆલ ફરમાવે છે કે હું સહન નથી કરી શકતો કે તમે ઈમાન લાવો અને તંગીમાં પડવા રહો. માટે અમે રોજા ફરજ કર્યા અલ્લાહ ફરમાવે છે કે જેથી તમારી તંગીઓ હુર થાય છે આ એવો બિંદુ છે જે મોભિનને મોભિન બનાવે છે. આ મોટી વાત યાદ રાખવા યોગ્ય છે. કે તમારા માટે સુવિધા ચાહે છે હુવિધા નથી ચાહતો. રોજામાં ભૂખ્યા-તરસ્યા રહેવું અથવા ધર્મ માટે બાલિદાન આપવું મનુષ્ય માટે હાનિકારક નથી બલ્કે સંપૂર્ણ રીતે લાભદાયક છે. જે આ વિચાર કરે છે કે મનુષ્ય રમાતુરમાં ભૂખ્યો રહે છે તે કુરાનને જુઠલાવે છે કેમ કે અલ્લાહ ફરમાવે છે કે તમે ભૂખ્યા હતા મેં રમાતુરને મોકલ્યો, જેથી તમે ખાઈ શકો આ રીતે માલુમ થયુ કે રોટી એ છે જે ખુદા ખવડાવે છે. તથા વાસ્તવિક જીવન તેમા જ છે તેના સિવાય જે રોટી છે તે રોટી નહી પથ્યર છે જે ખાનાર માટે વિનાશનું કારણ છે મોભિનનું કર્તવ્ય છે કે જે કોરિયુ તેના મો માં જાય તેના વિશે તે જોવે કે તે કોના માટે છે. જો તે ખુદા માટે છે તો તે જ રોટી છે જો પોતાના સ્વાર્થ માટે છે તો તે રોટી નથી.

હજુર અનવરે ફરમાવ્યુ સહેરી જો અલ્લાહના આદેશ અનુસાર ખાવામાં આવે છે તો જો સારી પણ ખાવામાં આવે તો તે અલ્લાહ માટે છે અને તેમાં બરકત છે અને જો પેટ ભરે છે સારુ ભોજન ખાવું છે. અને આનંદ પ્રાપ્તિ છે તો પછી પોતાના સ્વાર્થ

માટે છે.

યાત્રા તથા બીમારીમાં રોજો જાયા નથી હજરત મુસ્લેહ મૌંદ રીતે ફરમાવે છે મને સારી રીતે યાદ છે કે લગભગ મિરાઝ યાકુબ બેગ સાહેબ જે આજકાલ બિન બેઅત વાળા છે તથા તેમના લીડર માંથી છે, એકવાર બહારથી આવ્યા અસરનો સમય હતો હજરત મસીહ મૌંદ અ.સ. એ જોર આપ્યુ છે કે રોજો ખોલી નાખો ફરમાવ્યુ છે કે યાત્રામાં રોજો જાયા નથી તેવી જ રીતે એક વાર બીમારીનું વળણ થયું ફરમાવ્યુ કે અમારો આ તરીકો છે કે ધર્મ માં છુટ થી લાભ ઉઠાવવું જોઈએ ધર્મ સખ્તાઈ નહીં સરળતા શીખવે છે તે લોકો જે કહે છે કે બિમાર અને મુસાફર રોજો રાખી શકે તો રાખી લો તેને અમે ઉચિત નથી માનતા.

ક્યામ (કોઈ સ્થાને રોકાવું) દરમ્યાન રોજાના વિષયમાં હજરત મસીહ મૌંદ અ.સ. એ ફરમાવ્યુ કે જો કોઈ વ્યક્તિને એક સ્થાને ત્રણ દિવસ થી અધિક રોકાવું હોય તો પછી રોજો રાખે અને જો ત્રણ દિવસથી ઓછું રોકાવું હોય તો રોજો ન રાખે અને જો કાદિયાનમાં ઓછા દિવસ રોકાવું હોય તો તે રોજો રાખી લે અને પછી રોજા ફરીથી રાખવાની જરૂર નથી કારણ કે કાદિયાન આપણી બીજી વસ્તી છે આમા ત્રણ દિવસથી ઓછા સમયમાં પણ રાખવા ચાહે તો રાખી શકે છે. પરંતુ બીજા સ્થાનો પર ત્રણ દિવસ રોકાવાનું છે તો રોજા રાખી શકે છે

રોગી અને યાત્રીના રોજા રાખવા પર ચર્ચા હજરત મસીહ મૌંદ અ.સની મજલિસમાં થઈ હજરત મોહ્વી નુરુદીન સાહેબએ શેખ ઈબ્ને અરબી નું કથન કે રોગી અથવા યાત્રી રોજાના દિવસોમાં રોજો રાખીલે તો પણ તેને સ્વસ્થ થવા પર રમજાન મહિના વ્યતીત થયા પછી રોજા રાખવા જરૂરી છે. કારણ કે અલ્લાહ ફરમાવે છે જે તમારા માંથી બિમાર હોય અથવા સફરમાં હોય તે રમજાન મહિના પછીના દિવસોમાં રોજા રાખે અલ્લાહનો સ્પષ્ટ આદેશ છે કે તે પછી રોજા રાખે પછી ના રોજા તેના પર પ્રત્યેક અવસ્થામાં અનિવાર્ય છે વચ્ચેના રોજા તે રાખે તે અલગ વાત છે. તથા તેના મનની ઈચ્છા છે તેનાથી ખુદાતાલાના તે આદેશ જે પછી રાખવાના સંબંધમાં છે ટળી નથી શકતો હજરત મસીહ મૌંદ અ.સ. એ ફરમાવ્યુ કે જે વ્યક્તિ રોગી અથવા યાત્રી હોવાની અવસ્થામાં રમજાન મહિનામાં રોજા રાખે છે તે અલ્લાહના આદેશનું ઉલ્લાઘંન કરે છે અલ્લાહએ સ્પષ્ટ રીતે ફરમાવ્યુ છે કે રોગી અથવા યાત્રી રોજા ન રાખે રોગથી મુક્ત થયા પછી તથા યાત્રા સમાપ્ત કર્યા પછી રોજા રાખે અલ્લાહના આ નિર્દેશ અનુસાર કરવું જોઈએ કેમ કે મુક્તિ ખુદાના ફરજલથી થાય છે ન કે પોતાના કર્મના જોર દેખાડીને કોઈ મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. અલ્લાહએ આ નથી ફરમાવ્યુ કે રોગ નાનો હોય કે મોટો અને યાત્રા મોટી હોય કે નાની બલકે બધા માટે આદેશ છે તથા તેના અનુસાર કરવું જોઈએ રોગી અથવા યાત્રી રોજો રાખશે તો તેમના પર અવજ્ઞાનો ફતવો લાગશે.

હજરત સાહેબ જાદા મિરાઝ બસીર અહેમદ સાહેબ લખે છે કે રી. મીર મોહમ્મદ દિસ્માનીલ સાહેબે બયાન કર્યું કે એકવાર લુખિયાનામાં હજરત મસીહ મૌંદ અ.સ. એ રમજાનનો રોજો રાખ્યો હતો અને છુદય ઘટવાનો દોરો પ્રદ્યો તથા હાથપગ ઠંડા થઈ ગયા તે સમયે સુયાસ્ત થવાનો સમય નજીક હતો પરંતુ આપે તરત જ રોજો તોડી નાખ્યો આપ હંમેશા શરીરઅતમાં સરળ માર્ગ અપનાવતા હતા હજરત મિયાં બસીર અહેમદ સાહેબ ફરમાવે છે કે હું નિવદેન કરું છું કે હદીસમાં હજરત આયેશા રીતીની રિવાયતથી આંહજરત સ.અ.વ. ના વિષયમાં પણ આજ વાત આવે છે કે આપ હંમેશા જાયા માર્ગમાંથી સરળમાર્ગને પસંદ કરતા હતા.

ઘણીવાર રમજાન એવી ઋતુમાં આવે છે કે ખેતી કરનાર ને કામની અધિકતા હોય દા.ત વાવણી થઈ રહી હોય. અથવા પાક કપાતો હોય એવા મજુરોથી જેનું જીવન મજુરી પર છે અને રોજો નથી રખાતો પ્રશ્ન થયો કે એવા મજુરો વિશે શું નિર્દેશ છે? હજરત મસીહ મૌંદ અ.સ. એ ફરમાવ્યુ કે અલ આમાલો બિન્નીથ્યાત આ લોકો પોતાની અવસ્થાઓ છુપાવે છે પ્રત્યેક વ્યક્તિ તકવા અને શુદ્ધતા સાથે પોતાની અવસ્થા પર વિચાર કરી લે જો કોઈ પોતાના સ્થાન પર બીજાને મજુરી પર રાખી શકે છે તો એવુકરે, નહીંતર રોગીના આદેશમાં છે પછી જ્યારે સમય મળે રોજા રાખી લે.

ફિદ્યાયહના વિષયમાં હજરત મસીદ મૌંટ અ.સ. ફરમાવે છે કે એકવાર દિલમાં આયું કે ફિદ્યાયહ શા માટે સુનિશ્ચાત કર્યા છે. સામર્થ્ય મેળવવા માટે જેથી રોજાની તૌફિક તેના દ્વારા પ્રાપ્ત થાય. ખુદાતાલાનો જ અસ્તિત્વ છે જે સામર્થ્ય પ્રદાન કરે છે અને પ્રત્યેક વસ્તુ ખુદાતાલાથી જ માંગવી જોઈએ ખુદાતાલાતો સર્વ શક્તિમાન છે અને જો તે ચાહે તો એક સંકમજીક રોગીને પણ રોજા રાખવાની શક્તિ આપી શકે છે મારા વિચારમાં એ છે કે હુઅા કરે કે દિલાહી આ તારો મુખારક મહીનો છે. અને હું તેનાથી વંચિત થતો જઈ રહ્યો છું. અને શું ખબર કે આવતા વર્ષ જીવિત રહું કે ન રહું અથવા તે છુટેલ રોજા પુરા કરી શકું કે નહીં તથા તેનાથી તૌફિક માંગે મારો વિશ્વાસ છે કે એવા દિલને ખુદાતાલા શક્તિ આપી દેશે.

હજરત મસીદ મૌંટ અ.સ. ની સામે એક પ્રશ્ન આયો કે જે વ્યક્તિ રોજો રાખવાને યોગ્ય ન હોય તેના બદલે મેસ્કીનને ભોજન આપવા ચાહે તો તે ભોજનની રકમ કાઢિયાન યતીમ ફંડમાં મોકલવું ઉચ્ચિત છે કે નહીં. અથવા જે પણ હવે જમાઅતની વ્યવસ્થા છે તેમાં આપવી ઉચ્ચિત છે કે નહીં હજરત મસીદ મૌંટ અ.સ. એ ફરમાયું કે એક જ વાત છે પોતાના વિસ્તારમાં નિર્ધનને ભોજન કરાવે અથવા યતીમ ફંડમાં મોકલી હોય.

અજાણમાં ખાઈ પી લેવાની રોજો નથી ટુંટ્ટો. હજરત મસીદ મૌંટ અ.સ. ની સેવામાં પ્રશ્ન પેશ થયો કે હું સહેરીના સમયે રમજાનના મહીનામાં અંદર બેઠો અજાણમાં ખાતો પિતો રહ્યો. જ્યારે બહાર નિકળ્યો તો માલુમ થયું કે સર્ફદી પ્રકટ થઈ ગઈ છે. શું તે રોજો મારે ફરીથી મુકવો અનિવાર્ય છે કે નહીં આપે ફરમાયું કે અજાણમાં ખાખું પીધું તો તેના પર એ રોજાના બદલે બીજો રોજો રાખવું જરૂરી નથી જો અજાણમાં ખાઈ લીધું તો કોઈ હુવિધા નથી.

આયુનો પ્રશ્ન કે કંઈ આયુમાં રોજા રાખવો જોઈએ નાના મોટા બધા પુછે છે હજરત મુસ્લેહ મૌંટ રજી ફરમાવે છે કે આ વાત યાદ રાખવી જોઈએ કે શરીરાત એ નાની ઉમરના બાળકોને રોજા રાખવાથી રોકયા છે પરંતુ જ્યારે વ્યસ્ક થવા લાગે તો તેમને અમુક રોજા રાખવાનો અભ્યાસ અવશ્ય કરાવો જોઈએ આપ ફરમાવે છે કે મને જ્યાં સુધી યાદ છે હજરત મસીદ મૌંટ અ.સ. એ મને પહેલો રોજો રાખવાની અનુમતિ બાર અથવા તેર વર્ષની આયુમાં આપી હતી. પરંતુ કેટલાક મૂર્ખ લોકો છે સાત વર્ષના બાળકોને રોજો રખાવે છે અને સમજે છે કે એનો તેમને સવાબ મળશે. આ સવાબનો નહીં અત્યાચાર છે કેમ કે આ આયુ વધવાની હોય છે હાં એક આયુ તે હોય છે કે વ્યસ્ક થવાના દિવસો નજીક હોય છે તથા રોજા અનિવાર્ય થવાના જ હોય છે તે સમયે તેમને રોજાની અભ્યાસ અવશ્ય કરાવું જોઈએ. હજરત મસીદ મૌંટ અ.સ. ની અનુમિત અને સુન્નતને જો જોઈએ તો બાર તેર વર્ષની આયુની નજીક અભ્યાસ કરાવવો જોઈએ અને પ્રત્યેક વર્ષ અમુક રોજો રખાવા જોઈએ ત્યાં સુધી કે અદાર વર્ષની આયુ થઈ જાય જે મારા વિચારથી રોજા માટે વ્યસ્ક થવાની આયુ છે મને પહેલા વર્ષ માત્રા એક રોજો રાખવાની. હજરત મસીદ મૌંટ અ.સ. એ અનુમતિ આપી હતી.

હજરત અનવરે ફરમાયું જ્યારે રોજાની અનુમતિ અપાવી હતી બાર-તેર વર્ષની આયુમાં તો માત્ર એક રોજો રખાવ્યો હતો આ આયુમાં તો ફક્ત શોખ હોય છે તથા આ શોખના કારણે બાળકો અધિક રોજા રાખવા ચાહે છે પરંતુ આ માતા-પિતાનું કામ છે કે તેમને રોકે. પછી એક આયુ એવી હોય છે કે તેમાં બાળકોને સાહસ આપે કે તે પણ અમુક રોજા જરૂર રાખે. બાળપણમાં માતા-પિતાનું કામ છે કે રોકે અધિક ન મુકવા દે પછી જ્યારે જવાનીની આયુ આવી રહી છે તો પછી સાહસ અપાવે તથા અધિક રોજા રખાવે તથા સાથે જ એ પણ જોતા રહે કે તે અધિક રોજા ન રાખે અને જોનારને પણ એના પર આપત્તિ ન કરવી જોઈએ કે પુરા રોજા કેમ નથી રાખતો. કેમ કે બાળક જો આ આયુમાં પુરા રોજા રાખશે તો ભવિષ્યમાં નહીં રાખી શકે તેવી જ રીતે અમુક બાળકો બનાવત અનુસાર હુલ્લળ હોય છે. મેં જોયુ છે કે અમુક લોકો બાળકોને મારી પાસે લાવે છે અને જણાવે છે કે એની આયુ પંદર વર્ષની છે જ્યારે કે જોવાથી તે સાત આઈ વર્ષના લાગે છે હું સમજુછુ કે એવા બાળક રોજા માટે શાયદ એકવીસ વર્ષની આયુમાં વ્યસ્ક હોય. તેની તુલનામાં એક મજબુત બાળક શાયદ પંદર વર્ષની આયુમાં અદાર વર્ષને બરાબર થઈ શકે છે. પંદ્રતુ જો તે મારા આ શબ્દોને પકડીને બેસી રહે કે રોજાની વ્યસ્ક આયુ અદાર વર્ષ છે તો તે મારી સાથે ન્યાય નહીંકરે ના ખુદાતાલાલા સાથે બલ્કે પોતાની જાન પર અત્યાચાર કરશે તેવી જ રીતે જો કોઈ નાની આયુ નો બાળક પુરા રોજા ન રાખે અને લોકો તેના પર આપત્તિ કરે તો તે પોતાની જાન પર અત્યાચાર કરશે.

તરાવીદના વિષયમાં અકમલ સાહેબ ઓફ ગોલેક્શિઓ હજરત મસીહ મૌઓદ અ.સ. ને પુછાયું કે રમઝાન શરીફમાં રાત્રે ઉઠીને નમાજ પદ્ધવાનો આદેશ છે. અને સાધારણ પરિશ્રમી મજૂર તથા ખેતી કરનાર જે કર્મ કરવામાં ગફળત દેખાડે છે જો રાત્રીના પહેલા ભાગમાં તેમને અગ્યાર રકાત તરાવીદ પગાવી દઈએ તો શું ઉચિત છે હજરત અકદસ અ.સ. એ ઉત્તર આખ્યો કે કોઈ બુરાઈ નથી પડી લે

તરાવીદના વિષયમાં જગ્યાવ્યું કે જગ્યારે આ તહજજુદ છે તો વીસ રકાત પદ્ધવાના વિશે શું આદેશ છે કેમ કે તહજજુદ તો વિતર સહીત અગ્યાર અથવા તેર રકાત છે ફરમાવ્યું કે આંહરત સ.અ.વ. ની સ્થાયી સુન્નત તો તે જ આઠ રકાતો છે તથા આપ તહજજુદના સમયે જ પદ્ધતા હતા. તથા એ જ અફઝલ છે પરંતુ રાત્રીના પ્રથમ ભાગમાં પદ્ધવું પણ જાયજ છે. ઉચિત તો એજ છે કે તહજજુદના સમયે ઉઠીને આઠ રકાત પદ્ધવામાં આવે પરંતુ જો રાત્રીના પ્રથમ ભાગમાં પડી લે તો એ પણ જાયજ છે એક રિવાયતમાં છે કે આપે રાત્રીના પહેલા ભાગમાં પણ પડી છે. વીસ રકાતો તો બાદમાં પડી ગઈ. પરંતુ આંહરત સ.અ.વનો સુન્નત તે જ હતી. જે પહેલા બયાન થઈ. આ વીસ રકાતો અથવા અધિક રકાતો વાળી વાત બાદની છે આંહરત સ.અ.વનો તરીકો આઠ રકાત તહજજુદ છે.

ખુલ્બાના અંતમાં હજુંર અનવરે ફરમાવ્યું કે આ રીતે આ અમુક વાતો હતી રમઝાન વિશે જે મેં બયાન કરી છે. અલ્લાહ તાદાલા આપણા ને તકવા પર કાયમ રહેતા અલ્લાહ તાદાલાની પ્રસન્નતાને પ્રાથમિકતા આપતા રમઝાનના રોજાઓથી લાલ મેળવવાની તૌફીક આપે.

## Khulasa Khutba Jumma Huzoor Anwar 3 June 2016

### BOOK POST (PRINTED MATTER)

To, .....

.....  
.....